

ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી,અમદાવાદ

અનુસૂચિત જનજાતિ (ST) અનેઅનુસૂચિત જાતિ (SC) રિસર્ચ સેલ

સંશોધન દરખાસ્ત માટે આમંત્રણ

એસ.ટી. / એસ.સી. રિસર્ચ સેલ વિશે:

- ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 2002થી કાર્યરત એસ.સી. / એસ.ટી. સેલ અનુસૂચિત જાતિ (એસ.સી.) અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ (એસ.ટી.)ને સરકારે આપેલી મેટ્રિક પછીની શિષ્યવૃત્તિનો લાભ પૂરો પાડવાના પ્રાથમિક ઉદ્દેશ સાથે કાર્યરત છે.

યોજના:

- માનનીય કુલપતિશ્રીપ્રો. (ડૉ.) અમી ઉપાધ્યાયજીના નેતૃત્વ હેઠળ, એસ.સી. / એસ.ટી. સેલ એસ.ટી. અને એસ.સી. કેટેગરીના વિદ્યાર્થીઓ દ્વારા સંશોધન દરખાસ્તોને આમંત્રણ આપે છે.

કોણ અરજી કરી શકે :

- અરજદાર કોઈપણ માન્ય વિશ્વવિદ્યાલયથી અનુસ્નાતક પદવી ધરાવતા હોવા જોઈએ.

કેવી રીતે અરજી કરવી:

- તમામ દરખાસ્તો stsc.researchcell@baou.edu.in પર ઓનલાઇન સબમિટ કરવાની રહેશે.વધુ માહિતી અથવા માર્ગદર્શન માટે <http://iyotirmay.baou.edu.in/ssrcp/index.php/STSC-cell-registration> નો સંપર્ક કરી શકો છો.

સહયોગ:

- મહત્તમ રૂ. 25,000 / - (પચ્ચીસ હજાર).
- સંશોધન પ્રોજેક્ટનો સમયગાળો મહત્તમ 6 (છ) મહિનાનો રહેશે.

વ્યાપક વિષયવસ્તુ (થીમ):

- “અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ” સંબંધિત નીચે આપેલી વ્યાપક વિષયવસ્તુઓ સંદર્ભે સંશોધન દરખાસ્તો આમંત્રિત કરવામાં આવે છે. સંશોધન દરખાસ્તોનું શીર્ષક ‘અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ’ સંબંધિત બાબતો સાથે જોડાયેલ હોવું જરૂરી છે.
 - a). ઉચ્ચ શિક્ષણ
 - b). સામાજિક ન્યાય
 - c). સામાજિક અસમાનતા
 - d). ગ્રામીણ-શહેરી સ્થળાંતર
 - e). ટકાઉ વિકાસ લક્ષ્યાંકો
 - f). ઉદ્યોગ સાહસિકતા
 - g). સરકારી યોજનાઓ
 - h). આધુનિકીકરણ
 - i). અન્ય સંબંધિત ક્ષેત્રો

સંશોધન દરખાસ્તો માટે સબમિશન માર્ગદર્શિકા / સૂચનાઓ:

- નિમ્નલિખિત ઘટકોનો સમાવેશ કરવો જરૂરી છે:
 - a) સંશોધન વિષય
 - b) પૃષ્ઠભૂમિ અને અભ્યાસનો સંદર્ભ
 - c) પ્રસ્તાવિત અભ્યાસનો ઉદ્દેશ
 - d) સાહિત્યિક સમીક્ષા
 - e) સંશોધન પદ્ધતિ
 - f) અપેક્ષિત પરિણામો

- g) સૂચિત સમયરેખા / લક્ષ્યો
- h) જરૂરી અને ઉપલબ્ધ સંસાધનો
- i) સંદર્ભગ્રંથો કે ગ્રંથસૂચિની પસંદગી

- સંશોધન દરખાસ્ત માટે લઘુત્તમ શબ્દમર્યાદા 1000 શબ્દો અને મહત્તમ 1500 શબ્દો છે.
- પસંદ કરેલ સંશોધન દરખાસ્તને છ મહિના માટે રૂ. 25,000 (પચીસ હજાર)નું ભંડોળ અપાશે.
- અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં દરખાસ્તો સ્વીકારવામાં આવે છે.
- સંશોધનકાર્ય, ચકાસણી અને પસંદગી સમિતિ દ્વારા મંજૂરીની તારીખથી 6 (છ) મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે.
- લેખકોએ સંદર્ભસૂચિ માટે APA(7th edition)/MLA શૈલીને અનુસરવા વિનંતી છે.
- સ્ક્રૂટિની અને પસંદગી સમિતિ દ્વારા તમામ દરખાસ્તોની સમીક્ષા કરવામાં આવશે.
- સ્ક્રૂટિની અને પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.
- દરેક સંશોધનો દરખાસ્ત તેમજ સંશોધનનો આખરી અહેવાલનું ફરજિયાતપણે પ્લેજરિઝમ ચેક કરાવવાનું રહેશે. આ ચેકિંગ યુનિવર્સિટીના એન્ટિ-પ્લેજરિઝમ સોફ્ટવેર દ્વારા કરાશે. જો કોઈ સંશોધન દરખાસ્ત કે સંશોધન અહેવાલમાં 10 ટકાથી વધારે ક્યાંકથી નકલ કરેલું પકડાશે તો દરખાસ્ત કે અહેવાલને અમાન્ય ઠેરવીને અસ્વીકાર કરવામાં આવશે.
- આ યોજના અંતર્ગત યુનિવર્સિટીને રજૂ કરાયેલ સંશોધન દરખાસ્ત બીજે ક્યાંય સબમિટ કે પ્રકાશિત કરવામાં આવેલી ન હોવી જોઈએ. અન્ય પ્રકાશનો અથવા સામયિકોમાં મોકલવામાં આવશે તો તેને નિયમભંગ ગણીને અમાન્ય ઠેરવીને અસ્વીકાર કરવામાં આવશે.
- કોપિરાઇટ કાયદાના ઉલ્લંઘનના પરિણામે કોઈ કાનૂની બાબત સર્જાશે તો તેને માટે સંશોધક પોતે સંપૂર્ણપણે જવાબદાર રહેશે.

- સંશોધન દરખાસ્ત તેમજ આખરી અહેવાલ જમા કરાવતા પહેલાં કોપીરાઇટ કે અન્ય ક્લીયરન્સ મેળવવાની કાર્યવાહીની જવાબદારી સંપૂર્ણપણે સંશોધકની રહેશે.

દરખાસ્ત તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ:

I.	કાગળનો આકાર (Page Orientation)	ઊભો (Portrait)
II.	કાગળનું કદ (Page Size)	લેટર કે A4 (Letter or A4 size)
III.	હાંસિયો (Margins)	દરેક બાજુથી 1 ઈંચ (1 inch from all sides)
IV.	શીર્ષક (Headings)	Times New Roman કે શ્રુતિ કે મંગલ કે સંસ્કૃત 2003 (યુનિકોડ), Bold, Size-14 points, Title case
V.	પેટા શીર્ષક (Sub-Headings)	Times New Roman કે શ્રુતિ કે મંગલ કે સંસ્કૃત 2003 (યુનિકોડ), 12 points, Bold
VI.	મુખ્ય લખાણ (Body-text, paragraphs)	Times New Roman કે શ્રુતિ કે મંગલ કે સંસ્કૃત 2003 (યુનિકોડ), 12 points, Justified

સંશોધન દરખાસ્ત રજૂ કરવાની છેલ્લી તારીખ: **28th July, 2021**